

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ફેબ્રુઆરી 1 નાં રોજ બીજો વાર્ષિક બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ શરૂ કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 25, 2021) – સીટી ઓફ બ્રેમ્પટનનો પ્રખ્યાત ગાર્ડન પ્રોગ્રામ ફેબ્રુઆરી 1 નાં રોજ બીજા વર્ષમાં પ્રવેશશે.

આ પર્યાવરણ-અનુકૂળ પહેલ આપણાં શહેરમાં સહભાગીઓને પોતાનું બેક્યાર્ડ ગાર્ડન વિકસાવવા મફત માટી, બીયારણ અને મદદરૂપ થતા સૂચનો પૂરા પાડીને ખાદ્ય સુરક્ષાને ટેકો આપવામાં મદદરૂપ થાય છે. આ વર્ષનો કાર્યક્રમ ગત વર્ષ 2020 માં સહભાગી થવાની તક ન મેળવનાર લોકો સહિત, માત્ર નવા સહભાગીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.

બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ રહેવાસીઓને ઉત્પાદ અને ઔષધિઓ આરામથી પોતાના ઘરે ઉગાડવા, અને તેઓએ ઘરે ઉગાડેલો પાક સ્થાનિક ફૂડ બેંક્સ અને સામુદાયિક સંસ્થાઓને દાન આપવા પ્રોત્સાહિત કરે છે.

આ કાર્યક્રમ ખાદ્ય સુરક્ષા પર [મેયરની COVID-19 સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સની](#) ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલને ટેકો આપે છે અને સીટીને કાયમી હરિયાળુ શહેર બનાવવાની અગ્રતાને દૃઢ નિશ્ચયી બનાવે છે, અને રહેવાસીઓની માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે.

રહેવાસીઓ સોમવાર, ફેબ્રુઆરી 1 નાં રોજ, સવારે 10 વાગ્યે વેબસાઈટ www.brampton.ca/backyardgarden પર બીયારણ અને માટી મફત મેળવવા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ વર્ષના બેક્યાર્ડ ગાર્ડન-સ, બગીચાકામને લગતા સૂચનો, શૈક્ષણિક માહિતી અને સંસાધનો પણ વેબ પેજ પર ઉપલબ્ધ થશે. રહેવાસીઓને સોશિયલ મીડિયા પર પોતાના ગાર્ડન-સની માહિતી વહેંચવા હેશટેગ **#GardensofBrampton** નો ઉપયોગ કરવા આમંત્રિત કરવામાં આવે છે.

આ વર્ષે, આ કાર્યક્રમના ગૌરવપૂર્વક પ્રાયોજક સ્કોટ્સ (Scotts) બન્યા છે. આ શહેર મેટ્રોપોલીટીન લોમ્સ, પેરેડાઈઝ ડેવલપમેન્ટ્સ, ક્રિલ્ડગેટ ડેવલપમેન્ટ્સ, TACC ડેવલપમેન્ટ્સ, અને ગ્રેટ ગલ્ફ સહિતના બધાં કાર્યક્રમ સહાયકોનું આભારી છે.

બેક્યાર્ડ ગાર્ડન ક્લબ ઈ-ન્યૂઝલેટર

આ વર્ષે નવું, અમારા માસિક બેક્યાર્ડ ગાર્ડન ક્લબ ઈ-ન્યૂઝલેટરમાં જોડાશો. બધાં બાગકામ ઉત્સાહીઓ, સભ્યો બાગકામને લગતી માહિતી, પ્રશ્નો મોકલવાની તકો, નિષ્ણાતો અને સામુદાયિક ભાગીદારોની બાગકામને લગતી સલાહ અને સહાયતા, જેમ કે બ્રેમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી, અનોખી ઓફર્સ, અને ઘણું બધું સાથે માસિક ઈ-ન્યૂઝલેટર મેળવશે. ક્લબ માટે નોંધણી કરાવવા વેબસાઈટ www.brampton.ca/backyardgarden જુઓ.

બેકગ્રાઉન્ડ (પશ્ચાદભૂ)

સીટી ઓફ બ્રેમ્પટન માટે બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામનું ઉદઘાટન 2020 માં બહુ સફળ વર્ષ રહ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ રહેવાસીઓ માટે સ્થાનિક ફૂડ બેંક્સ અને નાઈટ્સ ટેબલ, રીજનરેશન, ખાલસા એઈડ્સ, અને યુનાઈટેડ શીપ્સ સહિતની સામુદાયિક સંસ્થાઓને 10,000 પાઉન્ડ્સ ઉપરાંતની ઊપજનું દાન એપ્રિલથી ઓક્ટોબર સુધી આપવામાં આવ્યું હતું. આ પહેલ COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં, કેનેડામાં શરૂ થયેલી તેના પ્રકારની પહેલી પહેલ હતી.

સામુદાયિક અગીચાઓનો કાર્યક્રમ બ્રમ્પટન ગ્રોન ગ્રીન એન્વાયરોનમેન્ટલ માસ્ટર પ્લાનના લક્ષ્યોને આગળ ધપાવે છે, જેમાં શહેરી ખેતીને શહેર માટે એક તક તરીકે દર્શાવી છે.

અવતરણો (ક્વોટ્સ):

“બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ ગયા વર્ષે બ્રમ્પટનમાં અવિશ્વસનીય રીતે સફળ રહ્યો હતો, અને મને એ ઘોષણા કરતા રોમાંચ થાય છે કે આ કાર્યક્રમ ફેબ્રુઆરી 1 નાં રોજ ફરીથી શરૂ થશે. આ કાર્યક્રમ આપણાં સમુદાયને સાથે લાવે છે, સહભાગીઓને સક્રિય રાખે છે, અને જરૂરિયાતમંદ રહેવાસીઓને ખાદ્ય સહાયતા પૂરી પાડે છે. કાઉન્સિલર વિહલન્સ (Whillans) ની આગેવાની હેઠળ બીજા વર્ષ માટે આ પહેલમાં ચેમ્પિયન બનવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન*

“હજારો રહેવાસીઓએ ગયા વર્ષે બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામના ભાગરૂપે મફત બીયારણ અને માટી મેળવી, જેનાથી જરૂરિયાતમંદ રહેવાસીઓને 10,000 પાઉન્ડ્સ ઉપરાંતની ઊંચા પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે, આ કાર્યક્રમ નવા સહભાગીઓ માટે ખુલ્લો છે - જેનો અર્થ એ થાય કે વધારે નવા સહભાગીઓ પાસે પણ આ ઉત્કૃષ્ટ પહેલમાં સહભાગી થવાની તક રહેશે. ભાગકામમાં પ્રવૃત્તમય થાવ, આઉટડોર્સનો આનંદ માણો, અને આ વર્ષે વળતર ચૂકવો!”

- *ડગ વિહલન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; પ્રમુખ, બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ, સીટી ઓફ બ્રમ્પટન*

“2020 માં બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ માટે મળેલી પ્રસ્તાવના અને જાહેરદસ્ત સમર્થનથી બ્રમ્પટન હકારાત્મક પ્રભાવિત થયું હતું, અને સીટી કર્મચારીગણ 2021 પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીમાં છે. તમારું બીયારણ અને માટી મફત મેળવવા, અને આ મહત્વની હરિયાળી પહેલનો ભાગ બનવા નોંધણી કરાવવા વેબસાઈટ www.brampton.ca/backyardgarden ને બૂકમાર્ક ચોક્કસ કરશો.”

- *ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca